

NC-113

November-2024

M.Com., Sem.-III**503 : Financial Services****Time : 2½ Hours]****[Max. Marks : 70**

સૂચનાઓ : (1) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.

(2) જમણી બાજુના આંકડા પ્રશ્નોના ગુણ દર્શાવે છે.

- | | | |
|----|--|----|
| 1. | શાખ ક્રમાંક એટલે શું ? શાખ ક્રમાંક પ્રાપ્ત કરવાની પ્રક્રિયા અને ચિહ્નો (પ્રતિકો) સમજાવો. | 14 |
| | અથવા | |
| 1. | (A) ટૂંકનોંધ લખો : નાણાકીય વ્યવસ્થાના એક ઘટક તરીકે નાણાકીય સેવાઓ | 7 |
| | (B) તફાવત લખો : પાકો આડતીયો (factoring) અને જપ્તી (forfeiting) | 7 |
| 2. | રોકાણ બેંકોના કાર્યો અને પ્રકારો સમજાવો. | 14 |
| | અથવા | |
| 2. | (A) ટૂંકનોંધ લખો : રીવર્સ મોર્ગેજ લોન (ઉલટાવેલ ગીરો લોન) | 7 |
| | (B) ટૂંકનોંધ લખો : મકાન બાંધકામ — નાણા સેવા સંસ્થાઓના પ્રકારો | 7 |
| 3. | નાદારી અને દેવાળીયાના ધોરણો — 2016 મુજબ નાદારી ઠરાવની પ્રક્રિયા સમજાવો. | 14 |
| | અથવા | |
| 3. | (A) સામાન્ય વીમો એટલે શું ? સામાન્ય વીમાના પ્રકારો સમજાવો. | 7 |
| | (B) સામાન્ય વીમા અને જીવન વીમા વચ્ચે તફાવત સમજાવો. | 7 |
| 4. | મ્યુચ્યુઅલ ફંડ એટલે શું ? ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ યોજના એટલે શું ? તે ક્લોઝ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ યોજનાથી કઈ રીતે અલગ પડે છે ? સમજાવો. | 14 |
| | અથવા | |
| 4. | (A) મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે કરવેરાની અસરો સમજાવો. | 7 |
| | (B) મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની પ્રક્રિયા સમજાવો. | 7 |

- (1) ભારતમાં ડિપોઝિટરી ધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ?
 (A) 1998 (B) 1999 (C) 2002 (D) 1996
- (2) રિઝર્વ બેંક અને 'સેબી' એ કયા નાણાકીય સાધન માટે કેડીટ રેટિંગ ફરજિયાત બનાવ્યું છે ?
 (A) પ્રેફરન્સ શેર (B) ડિબેન્ચર
 (C) રિડી. પ્રેફ. શેર (D) ઇક્વિટી શેર
- (3) નેશનલ સિક્યોરીટી ડિપોઝિટરી સેવાઓ (NSDL) લિ. ની સ્થાપના ક્યારે થઈ હતી ?
 (A) 1999 (B) 1994 (C) 1998 (D) 1996
- (4) 'B' શાખ ક્રમાંક એટલે શું ?
 (A) મધ્યમ સલામતી (B) અપૂરતી સલામતી
 (C) નબળી સલામતી (D) ખામીયુક્ત વહીવટ
- (5) નીચેના પૈકી કયું લક્ષણ શેર ઇસ્યુના સંદર્ભમાં વેપારી બેંકનું ગણાતું નથી ?
 (A) ભરણાના સંચાલન પ્રક્રિયામાં ભાગ લેવો
 (B) ભરણાના સંચાલનમાં મેનેજર તરીકે સેવા
 (C) લોકર ભાડે આપવું
 (D) કોર્પોરેટ સલાહકારી સેવા
- (6) ભારતમાં હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી ?
 (A) 1975 (B) 1978 (C) 1977 (D) 1974
- (7) ભારતમાં 14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
 (A) 1964 (B) 1972 (C) 1969 (D) 1991
- (8) લોન લેનાર મૂળ રકમનું વ્યાજ કેટલા દિવસમાં ચૂકવી ન શકે ત્યારે તેને નિષ્ક્રિય મિલકત ગણવામાં આવે છે ?
 (A) 60 દિવસો (B) 100 દિવસો (C) 90 દિવસો (D) 120 દિવસો
- (9) આરોગ્ય વીમાની મુદત કેટલા વર્ષની હોય છે ?
 (A) 5 વર્ષ (B) 1 વર્ષ (C) 3 વર્ષ (D) 10 વર્ષ
- (10) મ્યુચ્યુઅલ ફંડના ફાયદામાં કોનો સમાવેશ થાય છે ?
 (A) સેબીનું નિયંત્રણ (B) પારદર્શક પ્રક્રિયા
 (C) રોજનો NAVનો લાભ (D) આપેલ બધા

NC-113

November-2024

M.Com., Sem.-III**503 : Financial Services****Time : 2½ Hours]****[Max. Marks : 70**

- Instructions :** (1) All questions are compulsory.
 (2) Figures to the right indicate marks allocated to each question.

1. What is credit rating ? Explain the process and symbols of credit rating. **14**
OR
1. (A) Write a short note : Financial Services as a component of financial system. **7**
 (B) State the difference between factoring and forfeiting. **7**
2. Explain the functions and types of Investment Banks. **14**
OR
2. (A) Write a short note : Reverse – Mortgage Loan. **7**
 (B) Write a short note on types of Housing Finance Institutions. **7**
3. Explain Insolvency Resolution Process under Insolvency and Bankruptcy Code – 2016. **14**
OR
3. (A) What is General Insurance ? Explain the types of General Insurance. **7**
 (B) State the difference between General Insurance and Life Insurance. **7**
4. What is mutual fund ? What is an open ended mutual fund scheme ? How is it different from close-ended scheme ? Explain. **14**
OR
4. (A) Explain the tax implications for mutual fund investors. **7**
 (B) Explain the process of investment in mutual funds. **7**

5. Select correct option : (any seven)

- (1) From which year Depository Act came into force ?
 (A) 1998 (B) 1999 (C) 2002 (D) 1996
- (2) Credit Rating of which financial instrument is made compulsory by RBI and SEBI ?
 (A) Preference share (B) Debenture
 (C) Redeemable preference share ~~(D)~~ Equity share
- (3) When was National Securities Depository Ltd established ?
 (A) 1999 (B) 1994 (C) 1998 ~~(D)~~ 1996
- (4) What is 'B' credit rating ?
 (A) Medium safety (B) Non-enough safety
~~(C)~~ Weak safety ~~(D)~~ Defective administration
- (5) Which is not a characteristic of commercial bank from the following in case of issue of shares ?
 (A) Participation in Issue Management Process
 (B) Service as a Manager in Issue Management
 (C) To give locker on rent
 (D) Corporate Advisory Service
- (6) When was the Housing Development Finance Corporation established in India ?
 (A) 1975 (B) 1978 (C) 1977 (D) 1974
- (7) In which year 14 big banks were nationalized in India ?
 (A) 1964 (B) 1972 (C) 1969 (D) 1991
- (8) In how many days, a person cannot pay interest of loan then it is considered as a non-performing asset ?
 (A) 60 days (B) 100 days (C) 90 days (D) 120 days
- (9) What is the term of Health Insurance ?
 (A) 5 years (B) 1 year (C) 3 years (D) 10 years
- (10) Which is included in the benefits of Mutual Funds ?
 (A) Control of SEBI (B) Transparent process
 (C) Benefit of Daily NAV ~~(D)~~ All of the given